

પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર
સને-૨૦૨૨-૨૩

એસ્ટેટ મધ્યસ્થ કચેરી


એનેક્ષર-એ


(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧/૦૫/૨૦૦૯ ના પરિપત્ર ક્રમાંક:- પી.એ.ડી.-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪

આર.ટી.આઇ.સેલનું બિડાણ)

પ્રમાણપત્ર

- ૧) આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી (એસ્ટેટ મધ્યસ્થ કચેરી) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની યાદી મુજબના જાહેર સત્તા મંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર (પી.એ.ડી.) તૈયાર કરવામાં આવી છે. અને તા.૦૧/૦૫/૨૦૨૧ ની સ્થિતિએ તે અધ્યતન કરવામાં આવેલ છે. જેનું અમારા દ્વારા માહે મે-જૂન-૨૦૨૧ દરમ્યાન ઇન્સ્પેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે. અને જે બાબતે ક્ષતિ જણાઇ હતી અગર તો અપૂરતી વિગતો જણાઇ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.
- ૨) તા.૦૧/૦૫/૨૦૨૨ની સ્થિતિએ હવે કોઇ જાહેર સત્તા મંડળોના પ્રોએક્ટીવ-ડીસ્ક્લોઝર (પી.એ.ડી)નું ઇન્સ્પેક્શન-કમ-ઓડીટ બાકી રહેલ નથી.





અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

એસ્ટેટ ખાતુ
(મધ્યસ્થ કચેરી)

માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫
કલમ ૪ (૧) અન્વયે

આર.ટી.આઇ. પ્રોએક્ટીવ-ડીસ્ક્લોઝર બાબત

એસ્ટેટ ખાતુ
(મધ્યસ્થ કચેરી)

બી બ્લોક, ત્રીજો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧

Email address:- estateofficeramc@ahmedabadcity.gov.in

- જાહેર માહિતી અધિકારી :- (૧) શ્રી પરષોત્તમભાઈ રાણા(ઓ.એસ./ઈ.એમ.ઓ.)
(વહીવટી શાખા માટે)
- (૨) ઇન્સ્પેક્ટરશ્રી (જે તે ટેકનીકલ માહિતી માટે)
- અપીલ અધિકારી :- (૧) એસ્ટેટ ઓફિસરશ્રી મનીષ ભાઈ માસ્તર
(ટેકનીકલ બ્રાન્ચની માહિતી માટે)
- (૨) એચ.ઓ.ડી. શ્રી નાગરાજન નાયડુ
(વહીવટીશાખા તેમજ ટેકનીકલ બ્રાંચ સિવાયની શાખા માટે)

એસ્ટેટ વિભાગ-મધ્યસ્થ કચેરી

એસ્ટેટ મધ્યસ્થ કચેરી, ત્રીજો માળ, બી બ્લોક ,સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ.

મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જુદી જુદી મિલકતો આવેલી છે. જે મિલકતોના વહીવટની કામગીરી મુખ્યત્વે એસ્ટેટ ખાતામાંથી થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની મિલકતો જેવી કે ટાઉન હોલ, વિવિધ પ્રકારના મ્યુનિસિપલ હોલ, પીકનીક હાઉસ, પાર્ટી પ્લોટ,ઓડીટોરીયમ વિગેરે ભાડે આપવા અંગે નીતિ વિષયક બાબતોની કાર્યવાહી એસ્ટેટ વિભાગેથી થાય છે. વિવિધ પ્રકારના મ્યુનિસિપલ માલિકીના ક્વાર્ટસના ભાડા તથા વેચાણ અંગેની વહીવટી કામગીરી આ વિભાગેથી થાય છે. મ્યુનિસિપલ હદ અંગેના સર્ટીફિકેટ આપવા તેમજ નવી રોડ લાઇનો મુકવા તથા રસ્તાઓ, ચોક, અંડરપાસ, ઓવરબ્રીજ, વિગેરેના નામ આપવા અંગેના રેકર્ડની સાચવણીની કામગીરી આ વિભાગેથી થાય છે. જાહેર ખબરને લગતી નીતિ વિષયક બાબતો નક્કી કરવાની કામગીરી એસ્ટેટ વિભાગેથી થાય છે. મ્યુનિસિપલ માલિકીના પ્લોટો પ્રિમીયમથી વેચાણ આપવા કે ભાડાપટ્ટે આપવા અંગેની કાર્યવાહી અત્રેના વિભાગેથી કરવામાં આવે છે. મ્યુનિસિપલ રસ્તાઓ તથા મ્યુનિસિપલ મિલકતોમાં ખાનગી ટેલીફોન કંપનીઓને ઓ.એફ.સી.કેબલ તેમજ ટાવર પોલ/ સ્ટ્રકચર ઉભા કરવા અંગે જગ્યા ફાળવવાની નીતિ વિષયક બાબતો તેમજ મ્યુનિસિપલ રસ્તાઓ ઉપર ઇલેક્ટ્રીક કેબલો, ટેલીફોન કેબલો તથા ગેસ લાઇનો નાંખવા લેવાના થતા ભાડા સંદર્ભે નક્કી કરવાની થતી નીતિ વિષયક બાબતો તથા અન્ય તમામ પોલિસી વિષયક બાબતો એસ્ટેટ ખાતેથી કરવામાં આવે છે. અમદાવાદ શહેરના ઘન કચરાના તથા પ્રવાહી કચરાના નિકાલ અર્થે સુએઝ ફાર્મવાળી જમીનો અંગેની નીતિ-વિષયક કાર્યવાહી અત્રેથી હાથ ધરવામાં આવે છે. ભાડે આપવામાં આવેલ મ્યુનિસિપલ ક્વાર્ટસ તથા અન્ય મિલકતોમાં ભાડુઆત દ્વારા કરવામાં આવતા શરત ભંગ અંગે કેસ દાખલ કરવા તથા તેને આનુષંગિક કરવાની થતી તમામ કાર્યવાહી એસ્ટેટ ખાતાના સી.ઓ.પી વિભાગ દ્વારા કરવામાં આવે છે. આમ, એસ્ટેટ ખાતા દ્વારા મ્યુ.પ્રોપર્ટી અંગેની વહીવટી બાબતો અંગે કાર્યવાહી કરવામાં આવે છે.

દબાણ- સંકલન વિભાગ:-

અમદાવાદ શહેરમાં કોમર્શીયલ દબાણો તથા ધાર્મિક દબાણો અંગેની નીતિ વિષયક બાબતો, મ્યુ. રસ્તામાં નાખવામાં આવતા અંડરગ્રાઉન્ડ ટેલીફોન કેબલો, ઇલેક્ટ્રીક કેબલો, પાઇપ લાઇનો, ગેસ લાઇનોની વાર્ષિક ભાડા સહીતની નીતિ વિષયક બાબતો તથા ૨-જી,૩-જી અને ૪-જી સેવાઓ માટે મ્યુ.રસ્તા તથા મ્યુ.પ્લોટ કે જેમાં હયાત મ્યુનિ. મકાનો આવેલા હોય તેવા પ્લોટમાં ખુલ્લી જગ્યા ઉપલબ્ધ હોય અને તેની માંગણી ટેલીફોન કંપની દ્વારા કરાય તો તે પરત્વેની આનુષંગિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સ્ટ્રીટ વેંડર્સ પોલીસીની નીતિ વિષયક કામગીરી અત્રેના વિભાગે થાય છે, પાર્કીંગ અંગેની નીતિ વિષયક બાબતો અંગે આ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. વિકલાંગ શિક્ષિત બેરોજગારોને સમાજ સુરક્ષા નિયામકશ્રી દ્વારા નક્કી કરાયેલ લાભાર્થીઓને ટેલીફોન બુથ ફાળવવા અંગેની કાર્યવાહી આ વિભાગ અંતર્ગત થાય છે.

મ્યુ.કોર્પોરેશનને પ્રાપ્ત થયેલ રીઝર્વ પ્લોટોના જમીન મહેસૂલ ભરવાની કાર્યવાહી તથા મ્યુ.કોર્પોરેશનને વિવિધ વિભાગોને જાહેર હેતુ માટે સરકારી જમીનની જરૂરીયાત હોય તો તેવી જમીનોસરકારશ્રી પાસેથી મેળવવાની કાર્યવાહી પ્રોપર્ટી સર્વે વિભાગ દ્વારા કરવામાં આવે છે. મ્યુ.કોર્પોરેશનની હદના વિસ્તારોમાં આવતી વિવિધ ગુ.હા.બોર્ડ અને સ્લમ કલીયરન્સ બોર્ડ હસ્તકની વસાહતોના ખુલ્લા પ્લોટો અને આંતરિક રસ્તાઓના કબજા મેળવવાની નીતિ વિષયક બાબતો અંગે આ વિભાગેથી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧	શ્રી ફેનિલ પી. મહેતા	ઇન્સ્પેક્ટર
૨	શ્રી ઇલ્યાસ અહેમદ મો.અકરમ મોમીન	સબ ઇન્સ્પેક્ટર
૩	શ્રી વિક્રમભાઇ સોલંકી	સબ ઇન્સ્પેક્ટર
૪	શ્રી ગોવિંદભાઇ પી.ઠાકોર	સેની. સબ. ઇન્સ્પેક્ટર

એસ્ટેટ મેનેજમેન્ટ ઓફિસર બ્રાન્ચ:-

મ્યુનિ.કોર્પોરેશનની બાંધકામવાળી મિલકતો જેવી કે માર્કેટ, દુકાનો, મીની સ્ટોલ, સ્લમ ક્વાર્ટસ, ફીશ માર્કેટ વિગેરેના ભાડા તથા વેચાણ અંગેની નીતિ વિષયક બાબતો અંગે આ વિભાગેથી કાર્યવાહી કરવામાં આવે છે. તથા એસ્ટેટ મધ્યસ્થ કચેરી થી રેન્ટ ઉપર આપેલ મિલકતની મુદત વધારવાની કાર્યવાહી , મ્યુ.ક્વાર્ટસ કર્મચારી ને ફાળવવાની તેમજ ખાલી કરેલ ક્વાર્ટસ નો કબજો પરત મેળવવાની કાર્યવાહી, યુ.એલ.સી. અતંર્ગત તેમજ ક્વાર્ટસ વેચાણ અંગેની થયેલ કોર્ટમેટર માટે હાઇકોર્ટ/વકીલ નો સંપર્ક કરી માહિતી પુરી પાડવામાં આવે છે. નિવૃત્ત થતા કર્મચારીની સર્વિસબુક માં એસ્ટેટ ક્લીયરન્સ આપવા અંગે ની કામગીરી.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧	શ્રી પરષોત્તમભાઈ રાણા	ઇ.એમ.ઓ
૨	શ્રી શૈલેષભાઈ પટેલ	સીની.કલાર્ક
૩	શ્રી ભરતભાઈ બી.દવે	સર્વે બોય

લેન્ડ એકવીઝીશન વિભાગ:-

અ.મ્યુ.કોર્પોરેશનના વિવિધ વિભાગની જાહેર હેતુ માટેની કામગીરી માટે મ્યુ.વિસ્તારમાં ખાનગી જમીન/મિલકતોની જરૂરીયાત ઉભી થાય ત્યારે જે તે ખાતા દ્વારા સક્ષમ સત્તાની સૈધ્ધાંતિક મંજૂરી મેળવી એકવીઝીશન વિભાગને પ્રપોઝલ મોકલી આવ્યેથી માંગણીવાળી જમીન/મિલકતની સંપાદન અંગેની કામગીરી આ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. ધી.બી.પી.એમ.સી.એક્ટની કલમ ૭૭-૭૮ મુજબની કાર્યવાહી કરી, જે તે દરખાસ્ત સરકારશ્રીના એકવીઝીશન ઓફિસરને મોકલી આપવામાં આવે છે. લેન્ડ એકવીઝીશન ઓફિસરશ્રીના હુકમ અનુસાર સંપાદિત જમીનના કબજા લેવાની તથા એવોર્ડ મુજબ વળતર ચૂકવવાની કાર્યવાહી આ વિભાગ દ્વારા કરી, સંપાદિત જમીન / મિલકત જરૂરીયાતવાળા વિભાગને સોંપી દેવામાં આવે છે.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧	શ્રી મયુરસિંહ ગોહિલ	ઇન્સ્પેક્ટર(ઇન્ચાર્જ)
૨	શ્રી અંકિતકુમાર ટી.પટેલ	સબ ઇન્સ્પેક્ટર
૩	શ્રી પ્રદિપભાઈ પંચાલ	સર્વેયર
૪	શ્રી પ્રકાશ એસ.રાઠોડ	સર્વેબોય
૫	શ્રી અશ્વિન બી. રામી	સર્વેબોય

જી.ઇ.(પ્રોપર્ટી):-

ટી.પી.સ્કીમ રૂએ અ.મ્યુ.કોર્પોરેશનને પ્રાપ્ત થયેલ પ્લોટો જે તે હેતુ માટે ૯૯ વર્ષના ભાડા પટ્ટેથી આપવા અંગે ટેન્ડરની કાર્યવાહી આ વિભાગેથી થાય છે. ઔડા હસ્તકની બજાર કિંમત નક્કી કરી આપતી કમિટી સમક્ષ કામ રજૂ કરીને જમીન / મિલકતોની બજાર કિંમત નક્કી કરાવવાની કાર્યવાહી અત્રેના વિભાગેથી થાય છે તથા પ્રિમીયમની રકમ વસુલ લઇ, વાર્ષિક એડવાન્સ ભાડાની રકમ વસુલ લઇ બીજાં અન્ય ધોરણોએ પ્લોટ ફાળવવાની કાર્યવાહી અત્રેના જી.ઇ.(પ્રોપર્ટી) વિભાગેથી થાય છે.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧	શ્રી જીતેશભાઈ બી.ગુજ્જર	ઇન્સ્પેક્ટર
૨	શ્રીમતી ભુમિકાબેન ગાંધી	ઇન્સ્પેક્ટર
૩	શ્રી વિરલભાઈ કાળુભાઈ કંબોડી	સબ. ઇન્સ્પેક્ટર
૪	શ્રી અમિષભાઈ વી. ખિલવાણી	સબ. ઇન્સ્પેક્ટર

જાહેરખબર વિભાગ:-

અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા ઉપર તથા ખાનગી મિલકતોમાં જાહેર ખબરના હેતુસર હોર્ડીંગ્સ, વોલરેપ, કીચોસ્ક, ગેન્દ્રી વિગેરેની મંજૂરી અંગેની નીતિવિષયક બાબતોની કાર્યવાહી જાહેર ખબર વિભાગ દ્વારા કરવામાં આવે છે. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ટોકનભાડેથી મંજૂરી આપેલ કામચલાઉ રીતે ઉભા કરાવામાં આવતા હોર્ડીંગ્સના નાણાં વસુલ કરવાની કાર્યવાહી આ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧.	શ્રી નાગરાજન નાયડુ	એચ.ઓ.ડી.
૨.	શ્રી પ્રભુદાસ જી. પટેલ	આસી.એસ્ટેટ ઓફિસર
૩.	શ્રી વિશાલભાઈ એ. ભટ્ટ	ઇન્સ્પેક્ટર
૪.	શ્રી જિજ્ઞેશભાઈ પરમાર	ઇન્સ્પેક્ટર
૫.	શ્રી વરસીંહભાઈ જે. ભાભોર	ઓફિસ સુપ્રિટેન્ડન્ટ
૬.	શ્રી મુકેશભાઈ કે. પારગી	સબ ઇન્સ્પેક્ટર
૭.	શ્રીમતી બિંદીબેન એચ. વાવડીયા	સબ ઇન્સ્પેક્ટર
૮.	શ્રી અંકુરભાઈ સી. પટેલ	સબ ઇન્સ્પેક્ટર
૯.	શ્રીમતી શકુંતલાબેન એસ.કલારા	જુની.કલાર્ક
૧૦.	શ્રી ગુણવંતભાઈ જી. સોલંકી	સર્વે મજૂર

એસ્ટેટ ડ્રોઇંગ બ્રાન્ચ :-

- ૧ એસ્ટેટ ડ્રોઇંગ વિભાગ દ્વારા જુદા જુદા વિભાગેથી આવતા પત્રો તથા પત્રોનું મોનેટરીંગ /મૂલ્યાંકન કરવું તથા જે તે કર્મચારીને કામગીરી સોંપવી અને તૈયાર કરાવવું.
- ૨ અ.મ્યુ.કો.ના જુના કોટ વિસ્તારના તથા અમદાવાદ શહેરની હદમાં સમાવેશ તમામ ગામતળના નકશા તૈયાર કરવા તથા અમદાવાદ શહેરની હદમાં સમાવેશ જુના કોટ વિસ્તારના તથા તમામ ગામતળનાં પાર્ટ પ્લાનના નકશા બનાવવા તથા તેની જાળવણી કરવી.જરૂર જણાય તો સ્થળ પરિસ્થિતિની ચકાસણી કરવી.જુના કોટ વિસ્તારના તથા તમામ ગામતળના ઝોનિંગ સર્ટીફિકેટ બનાવવા, એસ્ટેટ ઓફિસરશ્રીની મંજૂરી થી મ્યુ.હદના પ્રમાણપત્રની નકલ આપવી.
- ૩ અ.મ્યુ.કોર્પોરેશનના ધી.બી.પી.એમ.સી.એકટ મુજબ રોડ લાઇન પ્રિસ્કાઇબ કરવાની જરૂરી મંજૂરી મેળવવાની કામગીરી તેમજ તે અંગેની દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત આપવી વાંઘા સૂચનો મંગાવવાં અને નિકાલ કરવો તથા નકશાઓ તૈયાર કરીને સ્ટે.કમિટી અને મ્યુનિ.કમિશનરશ્રીની મંજૂરી મેળવ્યા બાદ જે તે ઝોનને જાણ કરવી તથા તે કોપીઓ તથા જરૂરી ઠરાવની કોપીઓ રાખવી.
- ૪ એકવીઝીશન, જી.પ્રોપર્ટી સ્કીમ કપાત નાં ડ્રોઇંગ બનાવવા તથા અદલા બદલાનાં ડ્રોઇંગ બનાવવાં અદલા બદલાના સ્કેચ બનાવવા તેમજ દરેક ઝોનમાંથી આવતા વપરાશ પરવાંગી મેળવેલ તુમાર,એક્વિઝીશન ,જીઈ પ્રોપર્ટી,સ્કીમ કપાત દાનમાં મળેલ મિલકત વગેરેની દાખલા-બુકે જરૂરી નોંધ સાથે રાખવી.
- ૫ મ્યુનિ.કોર્પોરેશનના ઇલેક્શન વોર્ડના જરૂરી નકશા તૈયાર કરવા તથા વેચાણ આપવાના નકશા બાબતે જરૂરી મંજૂરી મેળવવી ને નિયત કરેલ ચાર્જ જમા કરેથી નકશા આપવા તેમજ સેન્સસને કામગીરી પણ કરવાની.
- ૬ અ.મ્યુનિ. કોર્પોરેશનના રસ્તા / ચોકના નામાવિધાન અંગેના રેકર્ડ રાખવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.તથા તે અંગે નામાભિમાન થયેલ છે કે નહિ તે અંગે અભિપ્રાય આપવો.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧	શ્રી ઋષિકેશભાઈ પંડ્યા	જુ.ડ્રાફ્ટસમેન
૨	શ્રી દુર્ગેશભાઈ પી.કારખાનીશ	જુ.ડ્રાફ્ટસમેન (i/c H.D)
૩	શ્રી ભરતભાઈ આર.રાવલ	જુ.ડ્રાફ્ટસમેન
૪	શ્રીમતી રશ્મિબેન જે.પંચાલ	પટાવાળા

-:કોમ્પીટન્ટ ઓફિસરની બ્રાન્ચ:-

મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં આવેલ ભાડાની મ્યુનિ.મિલકતોમાં જ્યારે પણ શરતભંગ તેમજ કોર્પોરેશનની જરૂરીયાત હોય ત્યારે જે મિલકતો પરત મેળવવાની થાય ત્યારે ઝોનમાંથી તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે. ગુજરાત પબ્લીક પ્રીમાઇસીઝ એક્ટ ૧૯૭૨ અન્વયે ટેનન્ટ-ઇન-એરીયર્સ પેટા ભાડુઆતે કરારની શરતોનો ભંગ, મકાન અને જમીનમાં ખાલી પ્રત્યક્ષ કબજા મેળવતાં પહેલાં કોર્પોરેશનના એડવોકેટ તરફથી ટેનન્સી ટર્મિનેટની નોટીસ આપવામાં આવે છે. ધી.બી.પી.એમ.એક્ટની કલમ-૪ થી શો કોઝ નોટીસ આપવામાં આવે છે. સામાવાળાને જાતે અથવા વકીલ રોકી ખૂલાસો કરવાની તક આપવામાં આવે છે. ત્યારબાદ જજમેન્ટના આધારે એક્ટની કલમ-૫ મુજબ ઇવીકશન ઓર્ડર બજાવીને મ્યુનિ. પ્રોપર્ટીનો ખાલી પ્રત્યક્ષ કબજો મેળવવામાં આવે છે.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧	શ્રી દિનેશભાઇ જે. આદરેજા	સીની.કલાર્ક (ઇન્ચાર્જ)
૨	શ્રી વિરેન્દ્રસિંહ રાઠોડ	જુનિ.કલાર્ક (ઇન્ચાર્જ)

સુએઝ ફાર્મ વિભાગ :-

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને સમગ્ર શહેરના અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સીસ્ટમ દ્વારા એકત્ર થતા ગંદા પાણીના નિકાલ માટે વર્ષો અગાઉ જમીન સંપાદન કરેલ સદરહુ જમીન બે ભાગમાં વહેંચાયેલ છે. જેમ કે સાબરમતી નદીના પૂર્વભાગે પીરાણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પશ્ચિમ તરફના ભાગે વાસણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે. પીરાણા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ જમીન સર્વે પ્રમાણે ૨૬૬૨ એકર છે. જ્યારે વાસણા પ્લાન્ટની કુલ જમીન ૪૬૦ એકર છે. આ જમીન અંગેના નીતિ વિષયક નિર્ણય અત્રેની કચેરીએથી કરવામાં આવે છે. આ તમામ જમીનોની સાચવણી જે તે સંબંધિત ઝોન દ્વારા કરવામાં આવે છે.

સ્ટાફ વિગત

અ.નં	નામ	હોદ્દો
૧	શ્રી મયુરસિંહ ગોહિલ	ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર
૨	શ્રી વિનયકુમાર શાંતીરામ ગોંડલીયા	સબ.ઇન્સ્પેક્ટર
૩	શ્રી જીજ્ઞેશભાઇ આઇ. મકવાણા	વોચમેન
૪	શ્રી કમલેશ બી. સોલંકી	વોચમેન

એસ્ટેટ પબ્લીક હોલ વિભાગ :-

1. એસ્ટેટ પબ્લીકહોલ વિભાગ દ્વારા ૩૪-કોમ્યુનીટી હોલ, ૧-પીકનીક હાઉસ, ૨૬-પાર્ટી-પ્લોટ, ૧-સરદાર પટેલ સ્ટેડિયમ , ૬-ઓડીટોરીયમ/ મેમો. હોલ, તથા ૨- ઓપન એર થિયેટર મળી કુલ-૭૪ જગ્યાઓની નીતિ વિષયક કામગીરી અત્રેનાં વિભાગેથી થાય છે. ત્યાર બાદની વહીવટીય કાર્યવાહી સંબંધિત ઝોન સ્તરેથી હાથ ધરવામાં આવે છે.
2. હોલ બુકીંગ કોઇપણ સિવિલ સેન્ટર પર અથવા ઓન-લાઇન બુકીંગ થાય છે. એક થી વધારે અરજીઓ આવે, તેવા કિસ્સાઓમાં છ માસ અગાઉ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવે છે. હોલ વપરાશ માટેની પરમીશન તથા તમામ વહીવટીય કામગીરી જે તે સંબંધિત ઝોન સ્તરેથી કરવામાં આવે છે.
3. સરકારી વિભાગો દ્વારા કરાતી હોલના વપરાશની વિશેષ પ્રકારની માંગણીઓ અનુસંધાને આનુષંગિક કાર્યવાહી આ વિભાગેથી હાથ ધરવામાં આવે છે.

સ્ટાફ વિગત

અ.નં.	નામ	હોદ્દો
૧	શ્રી નાગરાજન નાયડુ	એચ.ઓ.ડી.
૨	શ્રીમતી સ્નેહલતા બેન ચૌધરી	પી.એચ.એમ
૩	શ્રીમતી મનીષાબેન શાહ	સીની.કલાર્ક
૪	શ્રી મોહમ્મદએઝાઝ એ. મુન્સી	વોચમેન

એસ્ટેટ મધ્યસ્થ કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓનું લીસ્ટ

બી બ્લોક, ત્રીજો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧

Email address:- estateofficeramc@ahmedabadcity.gov.in

અનુ	નામ	હોદ્દો	ઓફીસ ફોન નં.	મો.નં	ગ્રેડ
૧.	શ્રી મનીષભાઈ માસ્તર	એસ્ટેટ ઓફિસર	---	૯૩૭૭૫૪૮૨૮૬	૭૮૮૦૦/૨૦૯૨૦૦
૨.	શ્રી નાગરાજન નાયડુ	એચ.ઓ.ડી.	---	૯૩૨૮૧૯૮૭૨૯	૭૮૮૦૦/૨૦૯૨૦૦
૩.	શ્રીમતી હેમાબેન શાકય	આસી.એસ્ટેટ ઓફિસર	---	૭૫૬૭૮૮૯૮૭૨	૫૩૧૦૦/૧૬૭૮૦૦
૪.	શ્રી પ્રભુદાસ પટેલ	આસી.એસ્ટેટ ઓફિસર	---	૯૮૭૯૫૨૪૨૮૨	૫૩૧૦૦/૧૬૭૮૦૦
૫.	શ્રી જીતેષ ભાઈ ગુર્જર	ઇન્સ્પેક્ટર (જી.ઇ.પ્રોપર્ટી)	---	૯૦૯૯૦૮૩૧૨૦	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૬.	શ્રીમતી ભુમિકાબેન ગાંધી	ઇન્સ્પેક્ટર (જી.ઇ.પ્રોપર્ટી)	---	૯૯૧૩૧૪૬૨૧૪	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૭.	શ્રી ફેનિલ પી. મહેતા	ઇન્સ્પેક્ટર (એ.ઇ.જનરલ)	---	૯૮૨૪૨૦૮૩૫૩	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૮.	શ્રી મયુરસિંહ ગોહિલ	ઇન્સ્પેક્ટર (એકવીઝીશન)	---	---	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૯.	શ્રી વિશાલ એ.ભટ્ટ	ઇન્સ્પેક્ટર(જા.ખ.)	---	૯૪૨૭૦૬૮૧૩૫	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૧૦.	શ્રી જિજ્ઞેશભાઈ એન.પરમાર	ઇન્સ્પેક્ટર(જા.ખ.)	---	૯૮૭૯૦૬૦૧૦૯	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૧૧.	શ્રી મયંકભાઈ મિસ્ત્રી	ઇન્સપેક્ટર (ડી.ઇ.ટી.પી.)	---	૯૮૭૯૦૬૦૧૦૯	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૧૨.	શ્રી પરષોત્તમભાઈ રાણા	ઇ.એમ.ઓ.	---	૭૦૬૯૦૪૦૮૨૮	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૧૩.	શ્રી વિરસિંહભાઈ જે.ભાભોર	ઓ.એસ	---	---	૪૪૯૦૦/૧૪૨૪૦૦
૧૪.	શ્રી મુકેશભાઈ કે. પારગી	સબ.ઇન્સ્પે. (જા.ખ.)	---	૯૯૭૯૭૨૩૯૩૪	૩૯૯૦૦/૧૨૬૬૦૦
૧૫.	શ્રીમતી બિંદી એચ. વાવડિયા	સબ.ઇન્સ્પે.(જા.ખ.)	---	---	૩૯૯૦૦/૧૨૬૬૦૦

૧૬.	શ્રી ભરતભાઈ આર.રાવલ	જુની.ડ્રાફ્ટસમેન (ડ્રોઇંગ બ્રાંચ)	---	૯૮૨૪૦૨૭૭૪૨	૩૫૪૦૦/૧૧૨૪૦૦
૧૭.	શ્રીમતી હેમાંગીની બેન સોલંકી	હેડક્લાર્ક (વહીવટી બ્રાંચ)	---	---	૩૫૪૦૦/૧૧૨૪૦૦
૧૮.	શ્રીમતી સ્નેહલતા બેન ચૌધરી	પી.એચ.એમ (હેડ ક્લાર્ક)	---	૯૬૩૮૪૩૨૫૨૭	૩૫૪૦૦/૧૧૨૪૦૦
૧૯.	શ્રીમતી મનીષાબેન શાહ	સીની.કલાર્ક	---	૯૮૭૯૦૬૦૩૩૩	૩૫૪૦૦/૧૧૨૪૦૦
૨૦.	શ્રીશૈલેષભાઈ એલ. પટેલ	સીની.કલાર્ક	---	૭૦૧૬૮૦૭૧૦૦	૩૫૪૦૦/૧૧૨૪૦૦
૨૧.	શ્રીમતી તેજલબેન ત્રિવેદી	સીની.કલાર્ક	---	૯૪૨૮૬૦૪૯૩૮	૩૫૪૦૦/૧૧૨૪૦૦
૨૨.	શ્રી ઋષિકેશભાઈ જી.પંડ્યા	જુની.ડ્રાફ્ટસમેન (ડ્રોઇંગ બ્રાંચ)	---	---	૩૫૪૦૦/૧૧૨૪૦૦
૨૩.	શ્રીમતી આશાબેન એ. ચૌહાણ	સીની.કલાર્ક	---	---	૨૫૫૦૦/૮૧૧૦૦
૨૪.	શ્રી દુર્ગેશ પી. કારખાનીશ	જુની.ડ્રાફ્ટસમેન (ડ્રોઇંગ બ્રાંચ)	---	૯૪૨૬૦૮૩૬૫૪	૨૫૫૦૦/૮૧૧૦૦
૨૫.	શ્રી ગોવિંદભાઈ પી.ઠાકોર	સેની.સબ.ઇન્સ્પે.(હોકર્સ લાયસન્સ)	---	૯૭૩૭૧૯૬૦૮૪	૨૫૫૦૦/૮૧૧૦૦
૨૬.	શ્રી ગોપાલભાઈ એફ. ઠાકોર	હેડક્લાર્ક (બીલક્લાર્ક બ્રાંચ)	---	૯૮૯૮૦૯૪૨૩૦	૩૪૩૦૦/-
૨૭.	શ્રી દિનેશભાઈ જે. આદરેજા	સીની.કલાર્ક(સી.ઓ.પી)	---	---	---
૨૮.	શ્રી ઇલ્યાસ અહેમદ મો.અક્રમ મોમીન	સહા.સબ.ઇન્સ્પે(એ.ઇ.દબાણ સંકલન)	---	૯૭૨૩૧૯૩૭૦૬	૩૮૦૯૦/-
૨૯.	શ્રી અંકુરભાઈ ચંદુભાઈ પટેલ	સહા.સબ.ઇન્સ્પે.(જા.ખ.)	---	---	૩૮૦૯૦/-
૩૦.	શ્રી વિક્રમભાઈ સોલંકી	સહા.સબ.ઇન્સ્પે.(એ.ઇ.દબાણ સંકલન)	---	૯૯૭૯૬૪૯૯૮૬	૩૮૦૯૦/-
૩૧.	શ્રી વિરલભાઈ કાળુભાઈ કંબોડી	સહા.સબ.ઇન્સ્પે. (જી.ઇ.પ્રો.)	---	---	૩૮૦૯૦/-

૩૨.	શ્રી વિનયકુમાર શાંતિરામ ગોંડલીયા	સહા.સબ.ઇન્સ્પે. (સુ.ફા.+ એક્વીઝીશન)	---	---	૩૮૦૯૦/-
૩૩.	શ્રી અંકિતકુમાર ટી. પટેલ	સહા.સબ.ઇન્સ્પેક્ટર(એક્વિઝીશન)			૩૮૦૯૦/-
૩૪.	શ્રી અમિષકુમાર વી. ખિલવાણી	સહા.સબ.ઇન્સ્પે. (જી.ઇ.પ્રો.)	---	---	૩૮૦૯૦/-
૩૫.	શ્રી વિપુલ આર.તડવી	સહા.સબ.ઇન્સ્પેક્ટર(ડી.ઇ. ટી.પી)	---	---	૩૮૦૯૦/-
૩૬.	શ્રી પ્રદિપભાઇ પંચાલ	સર્વેયર (એક્વીઝીશન)	---	---	૨૯૨૦૦/૯૨૩૦૦
૩૭.	શ્રીમતી શકુંતલા એસ.કલારા	જુ.કલાર્ક	---	૯૭૨૭૧૩૧૨૯૮	૧૯૯૦૦/૬૩૨૦૦
૩૮.	શ્રી હાર્દિક કુમાર આર. ચૌધરી	સ.જુ.કલાર્ક	---	---	૧૯૯૦૦/૬૩૨૦૦
૩૯.	શ્રીમતી દર્શિતાબેન પંચાલ	જુ.કલાર્ક	---	૭૮૭૪૪૪૭૬૫૫	૧૯૯૦૦/૬૩૨૦૦
૪૦.	શ્રી વિરેંદ્રસિંહ રાહોડ	જુ.કલાર્ક (AMTS માંથી ફાળવણી	---	---	૧૯૯૦૦/૬૩૨૦૦
૪૧.	શ્રી અજીતભાઇ જી રાહોડ	જુ.કલાર્ક (AMTS માંથી ફાળવણી)	----	---	૧૯૯૦૦/૬૩૨૦૦
૪૨.	શ્રી અશ્વિનભાઇ રામી.	સર્વેબોય	---	---	૧૫૦૦૦/૪૭૬૦૦
૪૩.	શ્રી ભરતભાઇ બી. દવે	સર્વેબોય	---	---	૧૫૦૦૦/૪૭૬૦૦
૪૪.	શ્રી પ્રકાશભાઇ એસ. રાહોડ	સર્વેબોય	---	---	૧૫૭૦૦/૫૦૦૦૦
૪૫.	શ્રી મહાદેવભાઇ ભરવાડ	પટાવાળા	---	---	૧૫૭૦૦/૫૦૦૦૦
૪૬.	શ્રી ચંદુભાઇ કે. વાળા	પટાવાળા	---	---	૧૫૭૦૦/૫૦૦૦૦
૪૭.	શ્રીમતી રશ્મિબેન જી. પંચાલ	પટાવાળા	---	---	૧૫૭૦૦/૫૦૦૦૦
૪૮.	શ્રી કનૈયાલાલ જી. ઠાકોર	પટાવાળા	---	---	૧૪૮૦૦/૪૭૧૦૦

૪૯.	શ્રી મેલાભાઈ એસ.સોલંકી	દબાણ મજૂર	---	---	૧૫૦૦૦/૪૭૬૦૦
૫૦.	શ્રી લઈકભાઈ ટી.મિરઝા	દબાણ મજૂર	---	---	૧૫૦૦૦/૪૭૬૦૦
૫૧.	શ્રી વિષ્ણુભાઈ બી. વાઘેલા	દબાણ મજૂર	---	---	૧૫૦૦૦/૪૭૬૦૦
૫૨.	શ્રી ગુણવંતભાઈ જી. સોલંકી	સર્વે મજૂર	---	---	૧૫૦૦૦/૪૭૬૦૦
૫૩.	શ્રીમતી ગોમતીબેન બી.રાવલ	મજૂર	---	---	૧૫૭૦૦/૫૦૦૦૦
૫૪.	શ્રી કમલેશ બી.સોલંકી	વોચમેન (સુ.ફા.)	---	---	૧૪૮૦૦/૪૭૧૦૦
૫૫.	શ્રી જીજ્ઞેશ મકવાણા	વોચમેન (સુ.ફાર્મ)	---	---	૧૪૮૦૦/૪૭૧૦૦
૫૬.	શ્રી મોહમ્મદએઝાઝ એ.મુન્સી	વોચમેન (પી.એચ.એમ)	----	----	૧૪૮૦૦/૪૭૧૦૦
૫૭.	તાહિર હુસૈન મકબુલ હુસૈન મલિક	વોચમેન	----	----	૧૪૮૦૦/૪૭૧૦૦